

ગાંધીનગર મહાનગરપાલિકા

પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન,

ફાયર સ્ટેશનની પાછળ, સેક્ટર-૧૭,

ગાંધીનગર-૩૮૨૦૧૬

:: ટેન્ડર ડોક્યુમેન્ટ ::

:: ટેન્ડર નં. ૫૭ ::

વર્ષ :- ૨૦૨૫-૨૬



ગાંધીનગર મહાનગરપાલિકા કચેરીની હસ્તકના।

કુડાસણ ખાતેનું કન્ટેનર નં. ૦૨ ભાડા પેટે

આપવા બાબત.

ગાંધીનગર મહાનગરપાલિકા



ગાંધીનગર મહાનગરપાલિકા કચેરીની હસ્તક કુડાસણ ખાતેનું કન્ટેનર નં.૦૨ ભાડા પેટે આપવા બાબત.

ટેન્કર પ્રક્રિયા ની અગત્યની તારીખો

૧.	ઓફલાઈન ટેન્કર ફ્રાફ્ટ ડાઉનલોડ કરવાની તારીખ અને સમય (ઓફલાઈન ટેન્કરનો ફ્રાફ્ટ અત્રેની કચેરીની વેબસાઇટ https://gandhinagarmunicipal.com/ અને https://e-Auction.nprocure.com પર ઉપલબ્ધ છે.)	તા.૨૧/૦૮/૨૦૨૫ સવારે ૧૧:૦૦ કલાક થી તા.૦૪/૦૯/૨૦૨૫ સાંજે ૦૬:૦૦ કલાક સુધી
૨.	પ્રિબીડ મીટિંગની તારીખ ,સમય અને સ્થળ	તા.૨૬/૦૮/૨૦૨૫ બપોરે ૦૧:૦૦ કલાકે
૩.	ઓફલાઈન ટેન્કર ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ તથા સમય	તા.૦૪/૦૯/૨૦૨૫ સાંજે ૦૬:૦૦ કલાક સુધી
૪.	ટેન્કર ફી ,ઈ.એમ.ડી. , તથા અન્ય માંગેલ દસ્તાવેજો રજીસ્ટર પોસ્ટ/સ્પીડ પોસ્ટ /કુરીયર થી સુપ્રત કરવાની અંતિમ તારીખ તથા સમય	તા.૦૬/૦૯/૨૦૨૫ સાંજે ૦૬:૦૦ કલાક સુધી
૫.	ટેકનીકલ બીડ ખોલવાની સંભવિત તારીખ અને સમય	તા.૦૮/૦૯/૨૦૨૫ બપોરે ૧૨:૦૦ કલાક સુધી
૬.	કન્ટેનર નંબર-૦૨ ની ઓનલાઈન ઓક્શન કરવાની સંભવિત તારીખ અને સમય	તા.૨૩/૦૯/૨૦૨૫ બપોરે ૦૧:૦૦ કલાકે
૭.	અંદાજીત રકમ (ત્રણ વર્ષ માટે કન્ટેનર ભાડે આપવાની અંદાજીત રકમ)	રૂ.૬,૦૦,૦૦૦/-
૮.	ટેન્કર ફી	રૂ.૧,૭૭૦/- (રૂ.૧૫૦૦/- + ૧૮% જ.એસ.ટી.-રૂ.૨૭૦/- =રૂ.૧૭૭૦/-)
૯.	ઈ.એમ.ડી	રૂ.૨૭,૦૦૦/-

ગાંધીનગર મહાનગરપાલિકા.

એસ્ટેટ શાખા

ક્રમ	વિગત	ઇજારદારશ્રીએ ભરવાની થતી વિગત
૧	ઇજારદારશ્રીનું નામ	
૨	ઇજારદારશ્રીની પેઢીનું નામ અને સરનામું/અધિકૃત કરેલ બ્યક્ટિનું નામ અને સરનામું	
૩	મોબાઈલ નંબર	
૪	પાન કાર્ડ નંબર	
૫	બેંક નું નામ	
	શાખા નું નામ	
	ખાતા નંબર	
	પ્રકાર (કર્ટ / સેવિંગ)	
૬	ઈ-મેઇલ આઈ.ડી.	
૭	આધારકાર્ડ નંબર	
૮	ગ્ર.એસ.ટી. નંબર	
<p>આ કામ ના ટેનકર ની તમામ શરતો અને સમજુતી અમોઅે વાંચેલ છે. તથા ઉપરોક્ત વિગતો સમજદારી પૂર્વક ભરેલ છે.</p> <p>(ભાવ ભરનાર પેઢી નું નામ સહી તથા સિક્કો)</p> <p>(દસ્તાવેજો સુપ્રત કરતી વખતે ઉપરોક્ત વિગતો સંપૂર્ણ ભરી અને રજુ કરવાની રેહશે.)</p>		

પરિશિષ્ટ-૧

ગાંધીનગર મહાનગરપાલિકા કચેરીની હસ્તકના કન્ટેનર નં.૦૨ ભાડા પોટે આપવા બાબતનું લાયકાત ફોર્મ.

ઓફલાઈન મોકલવાના દસ્તાવેજો:-

ક્રમ નંબર	વિગત	દસ્તાવેજની વિગત	જરૂરી ડોક્યુમેન્ટ બીડીલ છે કે કેમ	બીડીલ ડોક્યુમેન્ટ ના પાના નં.
૧.	ટેન્કર ફી રૂ.૧,૭૭૦/-નો ડી.ડી. (જો કોઈ ઈજારદારશ્રીને ટેન્કર ફી માં મુક્તિ મળવાપાત્ર હોઈ તો Gujarat state procurement policy-2024 માં જણાવ્યા મુજબ મુદ્દા નં. 04 (A)ના (a) to (h) માં જણાવેલ વિગત અંગેના આધારપુરાવા રજુ કરવાના રહેશે.)			
૨.	ઇ.એમ.ડી. રૂ.૨૭,૦૦૦/- ડી.ડી. /એફ.ડી.આર (જો કોઈ ઈજારદારશ્રીને ઇ.એમ.ડી. માં મુક્તિ મળવાપાત્ર હોઈ તો Gujarat state procurement policy-2024 માં જણાવ્યા મુજબ મુદ્દા નં. 04 (A)ના (a) to (h) માં જણાવેલ વિગત અંગેના આધારપુરાવા રજુ કરવાના રહેશે.)			
૩.	ટેન્કર ભરનાર એજન્સી નું નામ તથા સરનામું			
૪.	માલિક/અધિકૃત અધિકારી નું નામ /સરનામું			
૫.	ટેન્કર ભરનાર એજન્સી ની કોન્ટેક્ટ ડિટલ મોબાઇલ નંબર : -			
	ઇ-મેઈલ આઈ.ડી. :-			
૬.	GST રજીસ્ટ્રેશન સ્ટીફિકેટની નકલ			
૭.	આપક વેરા હેઠળ નોંધાયેલ PAN નંબર ની નકલ			
૮.	ઇજારાદારશ્રી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ નથી તે અંગેનું રૂ.૩૦૦/- ના સ્ટેમ્પેપર પર નોટરાઇડ ઓરીજનલ એકરાર નામું રજુ કરવાનું રહેશે.			
૯.	ઇજારાદારશ્રીનું પોલીસ વેરીફિકેશન કર્યાનું બાબતનું અધતન સહી સિક્કા સાથેનું ઓરીજનલ પ્રમાણપત્ર.			
૧૦.	ઇજારાદારશ્રી પાસે માન્યતાપ્રાપ્ત અને અધતન FSSAI Certificate ની નકલ.			
૧૧.	ઇજારાદારશ્રી પાસે માન્યતાપ્રાપ્ત અને અધતન ગુમાસ્તાધારા સ્ટીફિકેટની નકલ.			
૧૨.	ટેન્કરની અંદાજુત રકમ રૂ.૬,૦૦,૦૦૦/- છે. જેથી ૨૦૨૨-૨૩ ,૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ નું સેરાશ વાર્ષિક ટર્નઓવર રૂ.૧૮ લાખ થી વધુ હોવા અંગે સી.એ.નું માટે સ્ટીફિકેટ રજુ કરવાનું રહેશે.			
૧૩.	http://e-Auction.nprocure.com પરનું ટેન્કર ભરનાર એજન્સીનું ઓક્શન આઈ.ડી.			

ટેન્કર ભરનારની અધિકૃત વ્યક્તિની સહી /સિક્કો

કન્ટેનર અંગોળી માહિતી

ક્રમ	વિગત	માહિતી
૦૧	લોકેશન	લોકેશન અંગોળી ગુગલ લીક: https://maps.app.goo.gl/tsepFTTfw541yjy78 શ્રી કૃષ્ણાંજ કો-ઓપરેટીવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિ. ની સામે, ગૌરવ પથ, કુડાસાણા, ગાંધીનગર. (પીળા કલરના બે કન્ટેનર)
૦૨	માપ	૬.૦૫ મીટર * ૨.૩૮ મીટર
૦૩	ફોટોગ્રાફ	 A photograph showing two yellow shipping containers side-by-side on a paved area. The container on the left is labeled '1' and the one on the right is labeled '2'. They are positioned under some green foliage.

ટેનકરની શરતો:-

૧. શરતી ટેનકર સ્વીકારવામાં આવશે નહીં.
૨. ઈ-ટેનકર કમ ઈ-ઓક્ષનમાં ભાગ લેવા માટે સૌપ્રથમ ઉપર રજુસ્ટ્રેશન <http://e-Auction.nprocure.com> કરાવવાનું રહેશે. જેમણે અગાઉ રજુસ્ટ્રેશન કરાવેલ હોય તેમણે ફીથી રજુસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહીં. રજુસ્ટ્રેશન બાદ જ ઓક્ષનમાં ભાગ લેવા માટે <http://e-Auction.nprocure.com> ઉપર આગળની કાર્યવાહી કરવાની રહેશે.
ઈ-ઓક્ષન અંગે ઓનલાઈન રજુસ્ટ્રેશન કરાવી ટેકનીકલ બિડ સમય મર્યાદામાં ઓફલાઈન મોકલી આપવાના રહેશે. જો ટેનકર દ્વારા નિયત સમયગાળામાં ઈ.એમ.ડી. , ટેનકર ફી તથા અન્ય દસ્તાવેજો રજુસ્ટર પોસ્ટ, સ્પીડ પોસ્ટ થી સુપ્રત કરવામાં નહીં આવે તો તે ટેનકર ઈ-ઓક્ષનમાં ભાગ લઈ શકશે નહીં.
ટેનકર બંધ કવરમાં અને નિયત સમયમાં એસ્ટેટ શાખામાં મળે તે રીતે રજુસ્ટર પોસ્ટએકી અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયર થી અત્રેની કચેરીની એસ્ટેટ શાખામાં મોકલી આપવાનું રહેશે. ટપાલના કવર ઉપર “ગાંધીનગર મહાનગરપાલિકા કચેરીની છસ્તક ફુડાસાણ ખાતેનું કન્ટેનર નં. ૦૨ બાડા પેટે આપવા બાબત (એસ્ટેટ શાખા) ” એવું સ્પષ્ટ શબ્દોમાં લખવાનું રહેશે.
૩. આ કામગીરી અંગેની ટેનકર ફી (જો કોઈ ઈજારદારશ્રીને ટેનકર ફીમાં મુક્તિ મળવાપાત્ર હોઈ તો Gujarat State Procurement Policy-2024 માં જણાવ્યા મુજબના આધારપુરાવા રજુ કરવાના રહેશે) અને ઈ.એમ.ડી.ની રકમ ડી. ડી./એફ.ડી.આર. થી ભરવાની રહેશે. (જો કોઈ ઈજારદારશ્રીને ટેનકર ફીમાં મુક્તિ મળવાપાત્ર હોઈ તો Gujarat State Procurement Policy-2024 માં જણાવ્યા મુજબના આધારપુરાવા રજુ કરવાના રહેશે) જે “નાયબ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકા” ના નામનો બનાવવાનો રહેશે. જે ઈજારદારશ્રીઓના ટેકનીકલ બિડ મંજુર થશે તેમને જ ઓનલાઈન ઓક્ષનમાં ભાગ લેવા મળશે. ઓફલાઈન મોકલેલ દસ્તાવેજોના આધારે ઈવોલ્યુશન હાથ ધરવામાં આવશે. જે ઈજારદારશ્રીઓ ટેકનીકલ કવોલીફાય થશે તે ઈજારદારશ્રીઓને ઓનલાઈન ઓક્ષનમાં ભાગ લેવા હેતુસર પત્ર/ઈ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. ઓનલાઈન ઓક્ષનમાં મહત્વમાં ભાવ બેરેલ હોય તે ઈજારદારશ્રીને કન્ટેનર નં.૦૨ નો ઈજારો ટેનકરની શરતોને આધિન આપવામાં આવશે.
ટેનકર મંજુર થયેથી સિક્યોરિટી ડિપોઝિટની રકમ Gujarat State Procurement Policy-2024 મુજબ લેવામાં આવશે. જે “નાયબ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકા” ના નામનો બનાવવાનો રહેશે.
૪. ટેનકર મંજુર થયા બાદ ઈજારદારશ્રીએ ટેનકરની શરતોનું રૂ.૩૦૦/- ના સ્ટેમ્પેપર ઉપર જરૂરી કરારનામું કરી આપવાનું રહેશે અને ટેનકર અન્યથે જે અનામતની રકમ એફ.ડી.આર., એન.એસ.સી. અથવા અન્ય બચત પત્રના માદ્યમથી મુકવામાં આવે તો તેટલી અનામતની રકમ ઉપર મુંબઈ સ્ટેમ્પ અધિનિયમ ૧૯૮૮ ની અનુસુચિ-૧ ના આર્ટિકલ ૩૯ (ક) સાથે આર્ટિકલ ૨૦ (ક) મુજબ આ રીતે આપવામાં આવેલ અનામતની રકમમાં પ્રત્યેક રૂ.૧૦૦/- અથવા તેના ભાગ માટે રૂ.૬૦% ટકા પ્રમાણે સ્ટેમ્પ ડયુટી પાત્ર બને છે.
૫. ઈજારદારશ્રી કોઈપણ સરકારી કે બિનસરકારી સંસ્થા માં બ્લેકલીસ્ટ નહીં હોવાનું ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇડ ઓરીજનલ એકરાનનામું રજુ કરવાનું રહેશે.
૬. સમાન ભાવોના કિસ્સામાં કે અન્ય કોઈ કિસ્સામાં ઈજારદારની પાત્રતા, અનુભવ અને સક્ષમતા

આધારે આખરી નિએથ તથા ટેન્કર મંજુર કરવું, નામંજુર કરવું અથવા એક કરતાં વધુ એજન્સીને કામગીરી સોંપવી તેમજ કામગીરીમાં તકરાર કે વાંધો ઉભો થશે તો આખરી નિએથ મ્યુનિસિપલ કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકાનો રહેશે અને આવા કિસામાં ઈજારો કોઈ પણ જાતની નોટીસ આપ્યા સિવાય ઈજારો રદ કરી શકાશે અને સિક્યુરિટી ડીપોર્ટીટ જસ કરવામાં આવશે. ઈજારાના સમયમાં કોઈ તકરાર ઉભી થશે તો કાનુની ન્યાય ક્ષેત્ર ગાંધીનગર રહેશે.

૭. કન્ટેનર ભાડા પછેથી ચલાવવા માટે જે કન્ટેનર ની સૌથી ઉંચી બોલી / ભાવો મંજુર કરવામાં આવે તેણે જામીન અનામત પેટેની રકમ ૩.૧,૫૦,૦૦૦/- (અકે એક લાખ પંચાસ હજાર પુરા) (કન્ટેનર ઢીઠ અલગ-અલગ) નાચબ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકાના નામે રાષ્ટ્રીયકૃત બેંકનો ડી.ડી., બાંધી મુદતની થાપણ કે રાષ્ટ્રીય બચત પત્રો સ્વરૂપે અત્રેની કચેરીમાં જમા કરાવવાનો રહેશે. ટેન્કરમાં ઈજારાદારશ્રીએ તમામ ટેક્ષ સાથેના ભાવ બરવાના રહેશે. કન્ટેનર માટે લાગુ પડતા તમામ કરવેરા (જી.એસ.ટી. સહીત) ઈજારાદારશ્રીએ જ સમયસર બરપાઈ કરવાના રહેશે.
૮. ટેન્કરની ઓફર વેલીડીટી ૧૮૦ દિવસની રહેશે.
૯. જ્યારે ઈજારાદાર અને મહાનગરપાલિકા વચ્ચે કોઈપણ મુદ્દે વિવાદ, ગેરસમજ કે Dispute થાય ત્યારે સૌપ્રથમ આબદ્રિશન મારફત તકરાનો નિકાલ કરવાનો રહેશે.
૧૦. કન્ટેનર ભાડા પછીથી ચલાવવાના કરારની સમય મર્યાદા વ્યવસાય શરૂ કરવાનો વર્કઓર્ડર આપેથી ૦૩ (ત્રણ) વર્ષની રહેશે. આ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ગાંધીનગર મહાનગરપાલિકાને ચોગ્ય જણાશો તો પરસ્પરની સંમતીથી આ સમય મર્યાદા વધુમાં વધુ ૦૨ વર્ષ માટે લંબાવી/રીન્યુ થઈ શકશે અથવા ગાંધીનગર મહાનગરપાલિકા ઈચ્છશે તો નવેસરથી પછીની ઝાળવણીની કામગીરી હાથ ધરશે. દુકાનો ચલાવવા માટેના જરૂરી તમામ પરવાના કે અધિકાર પત્ર જે તે સક્ષમ કચેરી/સત્તાધિકારીશ્રી પાસેથી ઈજારાદારશ્રીએ જાતે સ્વખચ્ચે મેળવી લેવાના રહેશે. ઈજારાદારશ્રી દવારા જામીન અનામતની રકમ બરપાઈ થયા બાદ અત્રેથી કન્ટેનર શરૂ કરવાનો હુકમ આપેથી કન્ટેનર શરૂ કરવાની રહેશે.
૧૧. કોઈ પણ ઈજારાદારશ્રી કન્ટેનર માં બીડી, સિગારેટ, પાન- મસાલા, તમાકુ, ગુટકા, મધ્યપાન જેવા કોઈ પણ નશાકારક પદાર્થોનું સેવન અને વેચાણ કરી શકશે નહિં. કરારના સમય દરમ્યાન કોઈ ફર્નિચર ઈજારાદારશ્રી દવારા પોતાના ખર્ચે લાવવામાં આવે તો ફર્નિચર, માલસામાન, સાધન સામગ્રીની વિગત એસ્ટેટ શાખાને જાણ કરી તેની ચોક્કસ ચાદી રાખવાની રહેશે અને કરાર પૂર્ણ થયે આ ફર્નિચર માલસામાન, સાધન સામગ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજુરી મેળવી પરત લઈ જઈ શકશે. કરાર સમય દરમ્યાન કન્ટેનર મરામત અને ઝાળવણી, કલર કામ તથા સામાન્ય મરામત જેવી તમામ કામગીરી ઈજારાદારશ્રીએ પોતાના ખર્ચે કરવાની રહેશે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રી, કે તેના નિયત કરેલ પ્રતિનિધિ દવારા લેખિતમાં જણાવવામાં આવે તો આવી કામગીરી તુરત હાથ ધરી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ નિયત કરેલ સમયમાં પૂર્ણ કરવાની રહેશે ઈજારાદારશ્રી આ બાબતે નિષ્ફળ જશે તો દિન-૧૫ માં મ્યુનિસિપલ કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા દવારા કરાર રદ કરવામાં આવશે. કન્ટેનર ના સંચાલનથી આસપાસના વિસ્તારમાં રહીશોને ખલેલ ન પહોંચે તેની ઈજારાદારશ્રીએ કાળજી રાખવાની રહેશે જરૂરી પરમિશન ઈજારાદારશ્રીએ સ્વ-ખર્ચે

મેળવવાની રહેશે. કન્ટેનર ના સ્થળે કોઈપણ જાતની ગેરકાનૂની પ્રવૃત્તિ ન થાય તે અંગે ઈજારાદારશ્રીએ કાળજી લેવાની રહેશે. ઈજારાદારશ્રીએ સેવા માટે રાખેલ કર્મચારીઓ, ગ્રાહકો સાથે સભ્ય તથા વિવેકપૂર્ણ વર્તન કરે તેની કાળજી લેવાની રહેશે. અસભ્ય વર્તન કરતા માણસોને બદલી નવા માણસો મુકવા મ્યુનિસિપલ કમિશનરશ્રી, સૂચયે તો તેનો તુર્તજ અમલ કરવાનો રહેશે. આ જોગવાઈના ઉદ્દંધન માટે કરાર રદ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરશ્રીની રહેશે. ભવિષ્યમાં કોઈપણ ગેર કાનૂની પ્રવૃત્તિ થયાનું જણાશે તો તાત્કાલિક અસરથી દિન-૧૫ની નોટીસ આપી કરાર રદ કરી શકાશે. કન્ટેનર માં સહેલાણીઓ પ્રવાસીઓને ઝડપી અને સારી સુવિધા મળી રહે તે માટે ઈજારાદારશ્રીએ વિનયી, વિવેકી તેમજ નન્દ અને વિશ્વાસુ કર્મચારીઓ જરૂરીયાત મુજબ રાખવાના રહેશે.

૧૨. ઈજારાદારશ્રીએ ભાવપત્રકમાં ભરેલ ભાડુ પ્રથમ વર્ષ માટેનું છે. ત્યારબાદ દર વર્ષ ૭% (સાત ટકા) વધારો એટલે કે બીજા વર્ષે ભાવ પ્રથમ વર્ષે ભરેલ ભાવ કરતા ૧.૦૭ ગણા લેખે ચૂકવવાના રહેશે ત્યાર બાદ તે મુજબ પ્રતિ વર્ષ ૭% ભાવ વધારો થશે. વધેલ ભાડાના ૭ % પ્રમાણેની ગણતરી અને તે મુજબનું ભાડુ એડવાન્સમાં ક માસ માટેનું ભાડું નાયબ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકાને ચેકથી ચૂકવવાનું રહેશે. ઈજારાદારશ્રી દવારા એડવાન્સ ક માસ માટેનું ભાડું વર્ક-ઓડર મળ્યાના ૧૦ દિવસમાં ભાડુ ભરપાઈ ન કરે તો તે જેટલા દિવસ મોંડું ભરપાઈ કરે તેટલા દિવસનું ભાડાની રકમ ઉપરાંત ૧૮% લેખે બ્યાજ ભરપાઈ કરવાનું રહેશે અને એક માસ (૩૦ દિવસ) સુધી ભાડું ન ભરપાઈ કરે તો કરારખત આપોઆપ રદ ગણાશે.

૬.૬ા.

ક્રમ	વર્ષ	માસિક ભાડું	વાર્ષિક ભાડાની રકમ
૦૧	પ્રથમ વર્ષ ભાડું	૨૫,૦૦૦/-	૩,૦૦,૦૦૦/-
૦૨	બીજા વર્ષ ભાડું (પ્રથમ વર્ષ ભરેલ ભાવ કરતાં ૭% વધારો) (૨૫૦૦૦/-માસિક ભાડાની રકમ ના ૭% = ૧૭૫૦/-) (માસિક ભાડાની રકમમાં વધારો=૧૭૫૦/-)	૨૬,૭૫૦/-	૩,૨૧,૦૦૦/-
૦૩	ત્રીજા વર્ષ ભાડું (બીજા વર્ષ ભરેલ ભાવ કરતાં ૭% વધારો) (૨૬,૭૫૦/- ના ૭% વધારો =૧૮૭૨.૫/- એટલે કે ૧૮૭૩/-) (માસિક ભાડાની રકમમાં વધારો=૧૮૭૩/-)	૨૮૯૨૩/-	૩,૪૩,૪૭૦/-

ભાડું દર માસની ૦૧ થી ૦૫ તારીખ સુધીમાં ડી.ડી. નાયબ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકા ના નામથી ભરપાઈ કરી પહોંચ મેળવી લેવાની રહેશે. જે ચુક થયેથી પ્રતિ દિન ૩.૫૦૦/- પેનલ્ટી લેવામાં આવશે.

- ૧૩ કન્ટેનર માં ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકૃત અધિકારી/ કર્મચારી નિરીક્ષણ/ચકાસણી અર્થે પ્રવેશ કરવાનો અધિકાર ગમે તે સમયે અભાધિત રાખવામાં આવે છે.
- ૧૪ કન્ટેનર માં કામે રાજેલ કર્મચારીશ્રીઓને સરકારશ્રીના લઘુતમ વેતનદારા મુજબ પગાર ભથ્થા, અઠવાડિક રજા, પ્રો.ફંડ તેમજ મળવાપાત્ર વીમાના લાભ ઈજારાદારશ્રીએ સ્વખર્યે આપવાના રહેશે. તેમજ અન્ય મજુર કાયદા અને ગુમાસ્તા ધારાનો અમલ કરવાનો રહેશે.
- ૧૫ કન્ટેનર માં ઉપયોગ માત્ર ગ્રાહકોને ચા-કોફી, હંડા પીણા અને આઈર્કીમ ,ફાસ્ટ ફુડ નાસ્તો જેવી ચીજાયસ્તુઓ આપવા માટે જ છે. કન્ટેનરમાં શુદ્ધ શાકાહારી નાસ્તો પીરસવાનું રહેશે. નોન-વેજ નાસ્તો/ભોજન પીરસવાનું રહેશે નહીં. તેમાં ઈજારાદારશ્રી કે ઈજારાદારશ્રીના કર્મચારીઓ તેનો રહેવા કે સૂવા માટે ઉપયોગ કરી શકશે નહિં. કન્ટેનર માં ગ્રાહકોને આપવામાં આવતી ચીજાયસ્તુઓ શુદ્ધ, સ્વાદિષ્ટ, તાજુ અને સારી ગુણવત્તાવાળી આપવાની રહેશે તેમજ ખાદ્ય સામગ્રીના ભાવ દર્શાવતું બોર્ડ સ્થળ પર રાખવાનું રહેશે અને જરૂરી તમામ પરમિશન ઈજારાદારશ્રીએ સ્વ-ખર્ચે મેળવવાની રહેશે. કન્ટેનર અને તેની આજુ-બાજુની જગ્યા સ્વર્ચા અને આરોગ્યપ્રદ રાખવાની રહેશે. એઠવાડ, કચરો તેમજ બીજો કચરો ગંદવાડનો ચોગ્ય રીતે નિકાલ કરવાનો રહેશે તેને માટે અલગ-અલગ જરૂરિયાત મુજબની કચરા પેટી રાખવાની રહેશે અને તેમાં ઈજારાદારશ્રી કે ઈજારાદારશ્રીના કર્મચારીઓની બેદરકારી અંગે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જરૂરી સફાઈ કરાવી તેના ખર્યની રકમ ઈજારાદારશ્રી પાસેથી વસુલ કરવામાં આવશે. કન્ટેનર માં આપવામાં આવતી ચીજ વસ્તુઓનો ખાદ્યપદાર્થ હોય તો તે માટે ખોરાક અને ઓષ્ઠદ્ય નિયમન તંત્ર, ગાંધીનગર પાસેથી ગુણવત્તા અને શુદ્ધતાનું પ્રમાણપત્ર મેળવી કાફેટેરિયામાં ગ્રાહકોને દેખાય/વાંચી શકાય તે રીતે રાખવાનું રહેશે અને સમયાંતરે તેને રીન્યુ કરાવવાનું જવાબદારી ઈજારાદારશ્રીની રહેશે. કન્ટેનરમાં ગ્રાહકોને આપવામાં આવતી ચીજ વસ્તુના બીલના નાણા ઈજારાદારશ્રીએ જ મેળવી લેવાના રહેશે તેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની કોઈ જ જવાબદારી રહેશે નહિં. ઇંવસમાં ત્રણ વખત કન્ટેનરની આજુ-બાજુની સફાઈ કરવાની રહેશે. દરેક કન્ટેનરની અંદર કચરાપેટીની વ્યવસ્થા કરવાની રહેશે. કચરાનો નિકાલ મહાનગરપાલિકા દ્વારા મુકવામાં આવેલ કચરાપેટીમાં કરવાનો રહેશે. સફાઈ કામગીરી અંગે વારંવાર ફરિયાદ જોવા મળશે તો નોટીસ આપી સક્ષમ અધિકારી દ્વારા શરત ભંગ ગાણી સંબંધિત કન્ટેનર ધારકની ફાળવણી રદ કરવામાં આવશે. વીજળીના કનેક્શન સાથે ચેડા થાય કે વીજ ઓર્ટી અક્સમાત માટે કન્ટેનરના લાભાર્થી પોતે જવાબદાર રહેશે. કન્ટેનરનું કોઈપણ જાતનું રીપેરીંગ કામ પોતાના સ્વખર્યે કરવાનું રહેશે. કન્ટેનરની બહાર કોઈપણ જાતનું બોર્ડ કે દબાણ કરી શકશે નહિં. કુડકોર્ટના સંકુલમાં કોઈપણ પ્રકારના વાહન લઈ જવાની સખત મનાઈ હોઈ કન્ટેનરના લાભાર્થીના તેમજ ગ્રાહકોના વાહનો બરાબર રાખવાના રહેશે. આ બાબતની સંપૂર્ણ જવાબદારી એસોસિયેશન/ઇજારાદારશ્રીની રહેશે.
- ૧૬ કન્ટેનરમાં જરૂરીયાત મુજબ ગેસ ,વીજળી , પાણી ,ગાટર તથા અન્ય જરૂરી કનેક્શન ઈજારાદારશ્રીએ પોતાના ખર્ચે અને જવાબદારીએ કરાવવાના રહેશે.

કન્ટેનરમાંનું ગેસ વપરાશ/ વીજળી વપરાશ/ પાણી વપરાશના બીલો ,ગાટર વ્યવસ્થાના બીલો

- તथा અન્ય કનેક્શન લેવામાં આવે તો તેના બિલો જે તે કચેરીમાં ઈજારાદારશ્રીએ નિયમિત પણે બીલમાં દર્શાવિલ નિયત સમય મર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. ઈજારાદારશ્રીના બેદરકારીને કારણે કોઈપણ જોડાણ કપાઈ જશે તો તેને સ્વખર્ચે પુનઃચાલુ કરવાની જવાબદારી ઈજારાદારશ્રીની રહેશે.
- ૧૭ કરાર પૈકીની કોઈપણ શરતના બંગ બદલ દિન-૧૫ની નોટીસ આપી અધ્ય વચ્ચેથી કરાર રદ કરી શકાશે અને કન્ટેનર નો કબજો પરત આપવાનો રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકાના પક્ષેથી દિન-૧૫ અને ઈજારાદારશ્રી પક્ષેથી બે માસની નોટીસ આપી કરાર પૂરો કરી શકશે.
- ૧૮ કન્ટેનર માં જરૂરીયાત મુજબ અભિશામકની વ્યવસ્થા ઈજારાદારશ્રીએ જાતે કરવાની રહેશે. તેની સમયાંતરે ચકાસણી કરવાની અને અધતન રાખવાના રહેશે. જો તેમ કરવામાં કસુર થશે, અને તેના કારણે કોઈપણ પ્રકારનું નુકસાન થશે કે આગ ની ઘટના બનશે તો તેની સધળી જવાબદારી ઈજારાદારશ્રીની રહેશે. વધુમાં, ઈજારાદારશ્રીએ સ્વખર્ચે ફાયર, સ્વચ્છતા, વીમાની વ્યવસ્થા કરવાની રહેશે. જે અંગેની તમામ જવાબદારી ઈજારાદારશ્રીની રહેશે.
- ૧૯ કરાર પૂરો થયે કે રદ થયે દિન-૧૫મા કન્ટેનર ખાલી કરવાની રહેશે તેમ કરવામાં કસુર થયેથી કન્ટેનર નો કબજો સક્ષમ અધિકારીશ્રીની હાજરીમાં એકતરફી લઈ લેવામાં આવશે અને તે અંગે કોઈપણ કાનૂની કાર્યવાહી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ તેમજ ઈજારાદારશ્રી કન્ટેનરને મુકીને ચાલી જશે તો તેમાં હ્યાત વાસણો રાચરચીલું, વિદ્યુત સાધનો, ફર્નિચર કે અન્ય માલસામાનનો એક તરફી કબજો સરકારશ્રી લઈ લેશે તેમાં વાંધો કે વધ-ઘટનો પ્રશ્ન ઉપરિથિત કરી શકશે નહિ. જેનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકાનો રહેશે.
- ૨૦ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કન્ટેનર માટે નિયત કરેલ જગા/મકાનમાં ઈજારાદારશ્રી કોઈપણ સુધારો-વધારો કરી શકશે નહિ તેમજ જે સ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા એ ઈજારાદારશ્રી કન્ટેનર નો કબજો સોંપેલ હશે તે જ સ્થિતિમાં ઈજારાદારશ્રીએ કન્ટેનર માં કોઈપણ સુધારા-વધારા કર્યાનું જણાશે તો તેને મૂળ સ્થિતિમાં લાવવાની જવાબદારી ઈજારાદારશ્રીની રહેશે અને આ કામગીરી ઈજારાદારશ્રી ન કરે તો ત્રણ ગણા ખર્ચે અને જોખમે કન્ટેનરને મૂળ સ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા લાવશે અને આ ખર્ચની રકમ ઈજારાદારશ્રીના જામીન અનામતમાંથી વસુલ કરી બાકી રહેતી રકમ ઈજારાદારશ્રીને પરત કરવામાં આવશે.
- ૨૧ આ કન્ટેનર સંદર્ભે ગાંધીનગર મહાનગરપાલિકા અથવા અન્ય સત્તામંડળ પાસેથી કોઈ પૂર્વ પરવાનગી /મંજૂરીઓ/ લાઈસન્સ સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવી અત્રેની કચેરીમાં કરાર સાથે રજુ કરવાની રહેશે. જો કોઈ સત્તામંડળની પરવાનગી વગર કામગીરી કરી હશે તો તે તેની જવાબદારી ઈજારાદારશ્રીની રહેશે.
- ૨૨ ફાળવેલ તમામ ફૂડકોર્ટના લાભાર્થીઓને સરકારશ્રી તથા સ્થાનિક સત્તામંડળના વખતોવખતના નીતિનિયમો અનુસરવાના રહેશે. તેમજ પોલીસ કાયદાનો અમલ કરવાનો રહેશે. કોઈ પણ કિસામાં (ચોરી, લડાઈ, ઝડપ વગેરે..) પોલીસ કેસ કરવાના થાય અથવા પોલીસ કાર્યવાહી કરવાની થાય તેવા સંજોગોમાં તમામ જવાબદારી ઈજારાદારશ્રીની રહેશે. તેને સંલઘ પોલીસ કાર્યવાહી / કોઈ કચેરીની સંપુર્ણ કાર્યવાહી ઈજારાદારશ્રીએ કરવાની રહેશે.
- ૨૩ જે વ્યક્તિને કન્ટેનર ફાળવેલ હોય તેણે કોઈપણ અન્ય વ્યક્તિને લીજ/ બાડે/ પેટાભાડે આપી

શકશે નહિં. કન્ટેનરમાં પોતે જ વ્યવસાય કરવાનો રહેશે. અન્યથા ફાળવણી રદ કરી કન્ટેનરનો કબજો તાત્કાલિક અસરથી પરત લેવામાં આવશે.

૨૪. ઉપરોક્ત શરતો બાબતે આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકાનો રહેશે.
૨૫. ઈજારાદારશ્રીએ રૂ.૧૦૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર કચેરીએથી જણાવ્યા મુજબનો ભાડા કરાર કરવાનો રહેશે. જે દર ૧૧ માસે ઈજારાદારશ્રીએ રીન્યુ કરવાનો રહેશે. જે અંગેનો તમામ ખર્ચ ઈજારાદારશ્રીના શિરે રહેશે.
૨૬. રજીસ્ટ્રેશનની ઓનલાઈન પ્રક્રિયામાં ટેન્કરની બેઝ પ્રાઇઝ થી ઓક્શનની શરૂઆત કરવામાં આવશે અને હરાજુ સમયે ટેન્કરની બેઝ પ્રાઇઝ કરતાં વધુ બોલી/ઓક્શન ઓનલાઈન ભરવાની રહેશે. એક બીડ વધારવાની મીનીમમ વેલ્યુ રૂ.૫૦૦/- (Increment Factor) રહેશે.
૨૭. જે તે ટેન્કરમાં બેઝ પ્રાઇઝ ઉપર ઈ-ઓક્શન દરમિયાન બોલી/ઓક્શન તરીકે પ્રત્યેક વખતે ટેન્કરના નિયત કોરેલ લઘૃતમ વધારા સાથે કે તેના ગુણાંકમાં બોલીની રકમ બીડ કરવાની રહેશે. ઈ-ઓક્શન પુરા થવાના સમયગાળાની છેદ્ધી રૂપાંકના મિનિટ દરમિયાન બિડીંગ થતા બિડ પ્રક્રિયા બંધ થવાનો સમયગાળો વધુ રૂપાંકના સ્લેબમાં આપોઆપ વધતો જશે. આ મુજબ છેદ્ધી રૂપાંકના મિનિટ કોઈ બીડ વધારા (હાયર બિડીંગ ઇન્સ્ટન્ટ) વિના પસાર થયે જ બિડ પ્રક્રિયા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવશે.
૨૮. ઈ ઓક્શનની પ્રક્રિયા દરમિયાન બિડ પ્રક્રિયામાં ભાગ લેતા કોઈપણ બિડરનું નામ ડિસ્કલોડ (જાહેર) થશે નહિં. માત્ર જે તે બિડર પોતે જે તે બિડમાં હાઇએસ્ટ બિડર હોવાનું પોતાના લોગ-ઇનમાં જાણી શકશે.
૨૯. ઓનલાઈન ઓક્શનની પ્રક્રિયા સર્વર રીસ્પોન્સ ટાઈમ, ઇન્ટરનેટ સ્પીડ, સિસ્ટમ કેપેસીટી વગેરેને આધારિત હોઈ, બિડીંગ કરવા માટે બિડીંગ પૂર્ણ થવાની છેદ્ધી મિનિટ સુધી રાહ જોવી હિતાવહ નથી. દેરેક વખતે બિડ કરતા અગાઉ વેબ પેજ રિફેશ કરવું હિતાવહ છે. છેદ્ધી મિનિટમાં કરવામાં આવેલ બિડીંગને લીધે જો કોઈ પ્રશ્નો ઉદ્ઘલબે તો આ બાબતે મ્યુનિસિપલ કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકાનો નિર્ણય સર્વમાન્ય ગણાશે.

ઉપરોક્ત તમામ શરતો મેં વાંચી, સમજી, વિચારીને જાણામાં લીધી છે. તે સર્વે શરતો મને બંધનકર્તા રહેશે.

કોન્ટ્રાક્ટરની સહિ

કોન્ટ્રાક્ટરનું નામ તથા સરનામું :

નાથબ મ્યુનિસિપલ કમિશનર

ગાંધીનગર મહાનગરપાલિકા

ભાવ પત્રક (ઓનલાઈન ઓક્શન)

કન્ટેનર નંબર -૦૨

ક્રમ	માપ	કન્ટેનર નંબર-૦૨ ની અપસેટ વેલ્યુ
૧	૬.૦૫ મીટર* ૨.૩૮ મીટર	પ્રતિ માસ રૂ.૨૫,૦૦૦/-

-પ્રમાણપત્ર-

ટેન્કરની તમામ શરતો મે વાંચી સમજુ વિચારીને જાણામાં લીધી છે. આ સર્વે શરતો મને બંધનકર્તા રહેશે. ટેન્કર માટે કોઈ વિસંગતા નથી તે હું સ્વીકારું છું.

ટેન્કર ભરનારની અધિકૃત વ્યક્તિની

સહિ

કંપની/પેઢીનો રબ્બર સ્ટેમ્પ



ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

પર્સિટાઇનદયાળ ઉપાદયાય ભવન, ફાયર સ્ટેશનની પાછળ,

સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૬

ફોન: ૦૭૯ ૨૩૨૮૪૧૫૦ ફોન: ૦૭૯ ૨૩૨૨૧૪૧૯

Email: gmc8gandhinagar@gmail.com

Bidder Registration Step For e-Auction

URL: <https://e-Auction.nprocure.com>

Registration Process for Bidders:

1. Open the e-Auction Portal (<https://e-auction.nprocure.com>)
2. Click on the link "Register" on the e-Auction Homepage (Click on "Continue to Registration")
3. Select Login Type: "DSC Login".
4. Select Registration Type: Indian or Foreign
5. Choose the Auctioneer. Gandhinagar Municipal Corporation, Gandhinagar
6. Fill Section: USER DETAILS, BUSINESS DETAILS
7. Fill in Section Contact Person Click on Send OTP and verify for fields "Mobile" & "Alternate Mobile"
8. Agree, Enter Total, & click on "Register"

Based on successful registration, the Buyer will get confirmation "Thank You for Registration" and Confirmation mail on your registered e-mail ID.

Bidders may contact (n) Procure Helpdesk during office hours for Guidance/Technical Support.

(n) Procure Help Desk:

Toll-Free Number: 7359 021 663

Direct Number: 91-79-40007514/15/17

E-Mail: nprocure@ncode.in